

# રાજકોટ રૂરલ જીલ્લા :- પોલીસે કરેલ સારી કામગીરી

માહે- ડીસેમ્બર/૨૦૨૦

## એન.ડી.પી.એસ.ના કેસો-(૩)

- (૧) તા.૨૦/૧૨/૨૦૨૦ ના રોજ ધોરાજી પો.સ્ટે. વિસ્તારમાં એસ.ઓ.જી. શાખાના અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, રજાક ઇસ્માઇલ ખુરેશી રહે.ધોરાજી પાલાવાડ કાજી મસ્જીદ પાસે વાળો પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે નાર્કોટીક્સ (માદક પદાર્થ) નો જથ્થો રાખી તેનું હેરફેર વેચાણ કરવા માટે ધોરાજી મનહર ભેળ સામે આવેલ મુતરડી પાસે ઉભો હોવાની હકીકત મળેલ. જે હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ રેઈડ કરતા રજાકભાઈ ઇસ્માઇલખાઈ ખુરેશી જાતે સીપાઈ ઉ.વ.-૪૫ ધંધો-મજુરી રહે ધોરાજી પાલાવાડ કાજી મસ્જીદ સામે તા.ધોરાજી જી.રાજકોટ વાળો પોતાના કબજામાં ગેર કાયદેસર રીતે બદામી તથા ભુખરા રંગના ઓપીયમ ડેરીવેટીવ્સ (મોર્ફીન/હેરોઇન) નો જથ્થો કુલ વજન ૯ ગ્રામ અને ૬૫૦ મીલીગ્રામ કિ.રૂ.૯૬,૫૦૦/- નો રાખી વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવેલ. તેમજ રોકડ રૂપિયા ૨,૪૦૦/- મળી કુલ રૂ.૯૮,૯૦૦/- ગણી કબજે કરેલ તથા આરોપીને ક.૨૧/૧૫ વાગ્યે હસ્તગત કરી આરોપી વિરુદ્ધ ધોરાજી પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.૦૧૨૯/૨૦૨૦ એન.ડી.પી.એસ એક્ટ ક.૮(સી),૨૧(બી) મુજબ ગુન્હો રજી. કરાવેલ.
- (૨) વિરપુર પો.સ્ટે પાર્ટ બી ગુ.ર.નં ૧૧૨૧૧૨૧૩૦૦૧૨૦૦૬૮૭/૨૦ એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૮(સી),૨૦(બી)(૨-બી),૨૯ સ્થાનિક પોલીસ ગુન્હો શોધીકાઢેલ છે. તે એવી રીતે કે, આ કામના આરોપી (૧) રોનક ઉર્ફે રાજા ઇસુબભાઈ પઠાણ જાતે મુસ્લીમ ઉ.વ.-૨૩ ધંધો-મજુરી રહે ગોંડલ વોરાકોટડા રોડ આવાસ ક્વાર્ટર માં જી.રાજકોટ (૨) એઝાજ ઉર્ફે મામુ દિલાવરભાઈ બ્લોચ જાતે મકરાણી ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.ગોંડલ ગુંદાળા દરવાજા પાસે જી.રાજકોટ (૩) એઝાજ ઉર્ફે તેજો મેહમુદશા શાહમદાર જાતે ફકીર ઉ.વ.-૨૦ ધંધો-રી.ડ્રા. રહે ગોંડલ હુડકો સોસાયટી ચીસ્તીયા મસ્જીદ પાસે જી.રાજકોટ (૪) મહમદશા ઉર્ફે બાપુ ઇમરાનશા ફકીર રહે જેતપુર બળદેવધાર કેનાલ પાસે શૈલેષભાઈ ની દુકાન પાસે મો.નં-૯૦૮૧૫૩૮૦૭૬ વાળાઓ પૈકી નં.(૧),(૨) તથા (૩) નાઓએ આ કામના આરોપી નં.(૪) પાસેથી ગેર કાયદેસર રીતે વનસ્પતીજન્ય ગાંજાના ઘટકો વાળો માદક પદાર્થનો જથ્થો કુલ વજન ૨ કિલો ૧૦૦ ગ્રામ કિં.રૂ.૨૧,૦૦૦/- નો મેળવી સફેદ કલરની ટાટા કંપનીની ઇન્ડીગો ગાડી રજી નં. GJ-01-HN-0477 કિ.રૂ.૧,૦૦,૦૦૦/- વાળીમાં રાખી નીકળતા મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૧,૦૦૦/- તથા રોકડ રૂપિયા ૨,૨૦૦/- મળી કુલ રૂ.૧,૩૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે નં (૧) થી (૩) પકડાઈ જતા તેમજ પકડવા ઉપર બાકી રહેલ આરોપી નં (૪) નાઓએ સદરહુ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા ગુન્હો કર્યા બાબત.
- (૩) જેતપુર સીટી પો.સ્ટે. પાર્ટ-બી ૧૧૨૧૩૦૨૨૨૦૧૮૫૦/૨૦ એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૦ બી સ્થાનિક પોલીસ ગુન્હો શોધીકાઢેલ છે. તે એવી રીતે કે, આ કામના આરોપી મહમદશા ઉર્ફે બાપુ સ/ઓ ઇબ્રાહીમશા ઉર્ફે ઇમરાનશા સરવદી,જાતે ફકીર, રહે.બળદેવધાર,કેનાલ પાસે,નવાગઢ,જેતપુર,જી.રાજકોટ મુળ રહે. આખાગામ તા.વંથલી જી.જુનાગઢ વાળો પોતાના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં વનસ્પતીજન્ય ગાંજાના ઘટકો વાળો પદાર્થનો જથ્થો કુલ વજન ૧૪.૧૭૨ કિ.ગ્રા. ગ્રામ જેની કુલ કિંમત આશરે રૂ.૧,૪૧,૭૨૦/- તથા એક કાળા કલરનો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦ મળી કુલ રૂ.૧,૪૬,૭૨૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગુનો કર્યા બાબત.

ગેરકાયદેસર હથીયાર (આર્મ્સ એક્ટ) મુજબ કેસ : (૨)

- (૧) તા.૦૩/૧૨/૨૦૨૦ ના રોજ એસ.ઓ.જી.શાખાના અધિકારીશ્રી/કર્મચારીઓ શાપર(વે) પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, નેશનલ હાઇવે તેજસ્વી હનુમાન મંદિર પાસે અગાઉ રાજકોટ શહેરમાં હથીયારના ગુન્હામાં પકડાયેલ ઇસમ દિવલો કે જેને કાળા કલરનું પેન્ટ તથા લાલ અને ગ્રે કલરનો ચોકડીવાળો શર્ટ પહેરેલ છે. તે પોતાના પેન્ટના નેફામાં ગેરકાયદેસર રીતે હથીયાર રાખી આંટા ફેરા કરે છે. જે હકીકત આધારે હકિકત વાળી જગ્યાએ રેઈડ કરતા દિવ્યેશ ઉર્ફે દિવલો સ/ઓ જેરામભાઈ હુંમર જાતે પટેલ ઉ.વ.૩૧ ધંધો.મજુરી રહે.રાજકોટ રામનગર-૨ શેરી નં.૩ કોઠારીયા ચોકડી તા.જી.રાજકોટ મુળ શીવરાજગઢ તા.ગોંડલ જી.રાજકોટવાળો પોતાના કબ્જામાં ગેર કાયદેસર રીતે એક પીસ્ટલની કિ.રૂ.૨૦,૦૦૦/- તથા એક કાર્ટીઝની કિ.રૂ.૧૦૦/- એમ કુલ કિ.રૂ.૨૦,૧૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને ક.૧૮/૦૦ વાગ્યે અટક કરી આરોપી વિરૂધ્ધ શાપર(વે) પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.૧૨૩૧/૨૦૨૦ આર્મ્સ એક્ટ ક.૨૫(૧-બી),(એ) મુજબ ગુન્હો રજી. કરાવેલ.
- (૨) તા.૦૫/૧૨/૨૦૨૦ ના રોજ આટકોટ પો.સ્ટે. વિસ્તારમા એસ.ઓ.જી.શાખાના અધિકારીશ્રી/કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા દરમ્યાન બાતમીરાહે હકીકત મળેલ કે, આટકોટ થી ગોંડલ તરફ જવાના રસ્તા પાસે ભરત સોમાભાઈ ડેરવાળીયા રહે.નાના માત્રા તા.વિછીયાવાળો પોતાના પેન્ટના નેફામાં ગેરકાયદેસર રીતે હથીયાર રાખી ઉભેલ છે. જે હકીકત આધારે હકિકત વાળી જગ્યાએ રેઈડ કરતા ભરતભાઈ સોમાભાઈ ડેરવાળીયા જાતે કોળી ઉ.વ.૨૫ ધંધો.ઝાઇવીગ રહે.નાનામાત્રા તા.વિછીયા જી.રાજકોટવાળો પોતાના કબ્જામાં ગેર કાયદેસર રીતે એક પીસ્ટલની કિ.રૂ.૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને ક.૦૧/૦૦ વાગ્યે હસ્તગત કરી આરોપી વિરૂધ્ધ આટકોટ પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં.૦૬૨૨/૨૦૨૦ આર્મ્સ એક્ટ ક.૨૫(૧-બી),(એ) મુજબ ગુન્હો રજી. કરાવેલ.

-----